



**POLYLINK POLYMERS  
(INDIA) LIMITED**

CIN NO: L17299GJ1993PLC032905  
AN IS/ISO : 9001 : 2015 COMPANY

**Head Office :**

506, Saffron Building, Near Center Point,  
Ambawadi, Ahmedabad - 380 006.  
Phone : 079-26427800, 26565200  
Tele Fax : 91-79-26421864  
E-mail : polylink@polylinkpolymers.com  
Website : www.polylinkpolymers.com

**Registered Office (Works) :**

Block No. 229-230, Vill - Valthera,  
Dholka-Bagodara Highway,  
Taluka-Dholka,  
Dist.-Ahmedabad-382225

**Date: 24<sup>th</sup> May, 2025**

To,

The Secretary,  
Corporate Relationship Department,  
Bombay Stock Exchange,  
1st Floor, New Trading Ring,  
Rotunda Building, P.J. Towers,  
Dalal Street,  
Mumbai - 400 001

Scrip Code - 531454

Sub: Compliance under Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015

Dear Sir,

We would like to inform you that pursuant to Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ('LODR'), pleased find enclosed herewith copies of newspaper publication of audited financial result for the quarter and year ended 31<sup>st</sup> March, 2025 as approved in the Board Meeting held on dated 23<sup>rd</sup> May, 2025 in the following newspapers on 4<sup>th</sup> February, 2025

- The Newslane (Gujarati)
- Chanakya Ni Pothi (English)

This is for your information and record purpose.

**Yours Faithfully,**

**For, Polylink Polymers (India) Limited**

Raviprakash  
Harishankar  
Goyal  
**Raviprakash Goyal**  
**Whole Time Director**  
**DIN: 00040570**

Digitally signed by Raviprakash Harishankar Goyal  
DN: cn=Raviprakash Harishankar Goyal,  
pseudoym=B231d09884c30a0cc0f0db7657f,  
c=A, o=SEBI, ou=SEBI, email=harishankar.goyal@sebi.gov.in,  
serialNumber=4231f0a0c0176456825175950c1683,  
email=harishankar.goyal@sebi.gov.in,  
cn=Raviprakash Harishankar Goyal  
Date: 2025.05.24 10:32:50 +05'30'

Encl: As above

# ધી ન્યુઝલાઇન

વર્ષ : ૩૧  અંક : ૨૨૫ તા.૨૪-૫-૨૦૨૫  પાનાં ૪  માલિક : જયની પબ્લીશર્સ  તંત્રી : પરેશ ગંજવાલા, સહ તંત્રી : રાધિકા ગંજવાલા

# અમેરિકામાં બોન્ડ ઉપરના ચીલ્ડમાં તોતિંગ ઉછાળો



અશોક લેલેન્ડમાં આકર્ષણ વધારે છે

ગયા અઠવાડિયાના એક મહત્વના ડેવલપમેન્ટમાં રેટિંગ એજન્સી દ્વારા અમેરિકાના માથા ઉપર દેવાનો બોજો ખૂબ જ મોટો હોવાને કારણે તેના રેટિંગમાં ઘટાડો કરાયો. અને આ ડેવલપમેન્ટ પછી અમેરિકામાં બોન્ડ ઉપરના ચીલ્ડમાં તોતિંગ ઉછાળો જોવાયો છે.

૩૦ વર્ષની મુદતના ટ્રેઝરી બોન્ડમાં ચીલ્ડ હવે ૫.૧૬૧ ટકા ઉપર આવી ગયું છે જે એક્ટોબર, ૨૦૨૩ પછી સૌથી ઊંચા લેવલ છે અને તેવી જ રીતે ૧૦ વર્ષની ટ્રેઝરી બોન્ડ ઉપરનું ચીલ્ડ પણ ૪.૬૦ ટકા ઉપર પહોંચી ગયું છે અને આ બંને ટ્રેઝરી બોન્ડ ઉપરના ચીલ્ડમાં તીવ્ર ઉછાળાને કારણે સ્વાભાવિક છે કે શેરબજારના સેન્ટીમેન્ટને અસર પડે.

સરળ ભાષામાં સમજાવીએ તો અમેરિકામાં અસંખ્ય મોટા ઈન્વેસ્ટરો પોતાનું ભંડોળ ટ્રેઝરી બોન્ડ એટલે કે સરકારી જામીનગીરીઓ અને શેરબજાર વચ્ચે ફાળવતા હોય છે. હંમેશાં શેરબજારમાં અનિશ્ચિતતા વધારે હોય પરંતુ સાથે સાથે રિટર્ન વધારે મળે. જ્યારે બોન્ડમાં ચીલ્ડ ઓછું હોય પરંતુ સરકારી જામીનગીરી હોવાને કારણે સલામતી ખૂબ જ વધારે હોય છે અને સામે પક્ષે અસંખ્ય કંપનીઓએ જાન્યુઆરીથી માર્ચ માટેના પરિણામો નબળા દર્શાવ્યા છે. રીટેઈલ ગ્રાહકોમાં પણ ખાસ કોઈ ઉત્સાહ નહોતો દેખાતો અને ડિલરોનું સેન્ટીમેન્ટ પણ એકદમ સાવચેતીભર્યું હોવાને કારણે અને તેમના ગળામાં ખૂબ જ જંગી માલ ભેગો થઈ ગયો હોવાથી તેમણે પણ ઓર્ડરો ઘટાડી નાખ્યા હતા, પરંતુ એપ્રિલ મહિનાથી ઓટોમોબાઈલ સેક્ટરના સેન્ટીમેન્ટમાં થોડોઘણો સુધારો જોવાયો છે અને ઓપરેશન સિંદૂર પછી હવે ચોમાસા અંગેની પોઝિટિવ આગાહીઓને કારણે બજારના મૂડમાં સુધારો જોઈ શકાય છે. બીજા તરફ શેરબજાર પણ મજબૂત બન્યું છે અને તેથી લોકોના પોર્ટફોલિયોમાં નફો દેખાવા લાગતા તેમની ઓટોમોબાઈલની ખરીદી ઉપર પણ તેની પોઝિટિવ અસર જોઈ શકાય છે.

સામે પક્ષે અસંખ્ય કંપનીઓએ અનેક નવા મોડલો લોન્ચ કરવાની વ્યૂહરચના અપનાવી છે અને તેમાં એમજેએ પોતાના ચાર ઇલેક્ટ્રિક મોડલો લોન્ચ કર્યા પછી તેને સજજ્ઞ હરિકાઈ આપી શકાય તે માટે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા દ્વારા પણ આકર્ષક ડિઝાઈનના ઇલેક્ટ્રિક વાહનો લોન્ચ કરાયા છે અને તે પાછળ મે અને જૂન મહિના દરમ્યાન ઓટોમોબાઈલમાં વેચાણો જોરદાર રહેશે તે સંભાવના મજબૂત છે.

સામે પક્ષે સરકારના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટો પણ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યા છે અને તેને કારણે કોમર્શિયલ વાહનો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈકનીપમેન્ટના વેચાણોમાં પણ સુંદર ઉછાળો શરૂ થયો છે અને તેની અસર પણ આ કંપનીઓના નફાના આંકડા ઉપર જોઈ શકાયો.

આગામી સમયગાળામાં બંને ઓટોમોબાઈલ કંપનીઓ હીરોમોટો કોર્પ અને બજાર ઉપર આ બંને કંપનીઓ રોકાણકારોને સુંદર રિટર્ન આપે તે રીતે ઉંચકાઈ રહ્યા છે. **હીરો મોટોકોર્પ** દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં બોટમલાઈનમાં વાર્ષિક ૮.૬૪ ટકાની વૃદ્ધિ હાંસલ થઈ છે પરંતુ માર્ચ ક્વાર્ટરમાં નફો ૨૪.૨૧ ટકાનો તોતિંગ ઉછાળો દર્શાવે છે. આ શેર અત્યારે ૧૯.૭૭ના પીઈરેશિયો ઉપર રૂા. ૪૭૨૪ ઉપર મળે છે અને તેમાં આવતા થોડા દિવસો દરમ્યાન સુંદર ઉછાળા સાથે રૂા. ૪૪૦૦ અને તે પછી ધીરે ધીરે રૂા. ૪૫૦૦નો ભાવ જોવા મળે તે સંભાવના મજબૂત છે.

સામે પક્ષે **બજાજ ઓટો** વેચાણો અને નફાની દૃષ્ટિએ હીરો મોટોકોર્પ કરતા ખૂબ જ આગળ છે તેનો શેર અત્યારે ૩૨.૫૫ના પીઈરેશિયો ઉપર અને રૂા. ૮૭૬૬ ઉપર ચાલે છે અને તે રીતે જોઈએ તો હીરો મોટોકોર્પ કરતા ડબલ ભાવ ઉપર કહી શકાય. આ શેરમાં પણ અત્યારે વોલ્યુમ જોરદાર છે. સરેરાશ ૪૪૨૦૦૦ શેરોનું વોલ્યુમ

સરખામણી કરે છે અને એટલે ગયા અઠવાડિયા પણ આ શેરમાં ફોકસ રાખવાનું કહ્યું હતું. વધીને રૂા. ૩૬૩૬ ઉપર આવ્યો છે. જાળવી રાખજો અને આવતા થોડા દિવસોમાં આ શેરમાં મજબૂત અપટેન્ડ સાથે રૂા. ૩૭૩૭ અને તે પછી રૂા. ૩૮૩૮નો ભાવ આવવાની આરએસની વાત.

**ટાઈફ્ટ**, એવરગ્રીન શેર છે અને એટલે ગયા અઠવાડિયા પણ આ શેરમાં ફોકસ રાખવાનું કર્યું હતું. વધીને રૂા. ૧૫૭ ઉપર આવી ગયો છે. વધારે નહિ તો ૧૦૦-૨૦૦ શેર લઈને મૂકી દેજો અને તેમાં આવતા થોડા દિવસો દરમ્યાન રૂા.૧૬૦ અને તે પછી રૂા. ૧૬૪નો ભાવ જોવા મળે તો નવાઈ નહિ લાગે.

**ટાઈફ્ટ**, એવરગ્રીન શેર છે અને એટલે ગયા અઠવાડિયા પણ આ શેરમાં ફોકસ રાખવાનું કર્યું હતું. વધીને રૂા. ૩૬૩૬ ઉપર આવ્યો છે. જાળવી રાખજો અને આવતા થોડા દિવસોમાં આ શેરમાં મજબૂત અપટેન્ડ સાથે રૂા. ૩૭૩૭ અને તે પછી રૂા. ૩૮૩૮નો ભાવ આવવાની આરએસની વાત. **હટ્તલ**, એમેટોએ હવે આ નવું નામ અપનાવ્યું છે. રૂા. ૨૪૪ ઉપર આવી ગયેલા આ શેરમાં ભલે માર્ચ ક્વાર્ટરનું નુકસાન નબળું આવ્યું, પરંતુ જે રીતે ઈ-કોમર્સમાં રોકેડગતિએ માર્કેટ કવર કરે છે તે જોતા ખેલાડીઓનું જોરદાર આકર્ષણ, વેચવાની ઉતાવળ ન કરતા અને આવતા થોડા દિવસોમાં જ આ શેરમાં સુંદર ઉછાળા સાથે રૂા. ૨૫૨ અને તે પછી રૂા. ૨૬૨નો ભાવ જોવા મળી જાની સંભાવના મજબૂત છે.

**મારૂતિ સુઝુકી**, રૂા. ૧૨૯૫ના ભાવે આ શેરને ધ્યાનમાં રાખવો અને હવેના ઉછાળે આ શેરમાં તોતિંગ રિટર્નની જગ્યા. સેન્ટીમેન્ટ સુધરવાને કારણે વાહનોના વેચાણો પણ ઝડપથી ઉંચકાય જાય છે આપું માર્કેટ વિસ્તૃત થવાની ગણતરી. શોર્ટટર્મમાં જ રૂા. ૧૩૧૩૪ અને તે પછીના થોડા દિવસોમાં રૂા. ૧૩૩૨૦નો ભાવ જોવા મળવાની ગણતરી મજબૂત છે. એક કે બે શેર લઈને મૂકી શકાય.



તેથી મોટા ઈન્વેસ્ટરો પોતાનું ભંડોળ ૬૦:૪૦ અથવા તો ૭૦:૩૦ના રેશિયોમાં ફાળવતા હોય છે પરંતુ જ્યારે અત્યારે બન્યું છે તે રીતે સરકારી જામીનગીરી ઉપરનું ચીલ્ડ એકદમ વધી જાય તો અનેક જા્યન્ટ ઈન્વેસ્ટરો પોતાનું ભંડોળ શેરબજારમાંથી ખેંચીને સલામત રીતે ૫.૧૬ ટકાનું રિટર્ન મળતું હોય તો તેમાં શિકેટ કરવાનું પસંદ કરે અને આ પાસાને કારણે એમેરિકન શેરબજારમાં છેલ્લી ત્રણેક સેશનથી વચેવાલીનું દબાણ રહ્યું છે. સામે પક્ષે એશિયાઈ માર્કેટોમાં પણ સિવિલ આર્થિક આંકડાઓની ચાહ જોવાય છે અને તેને કારણે અત્યારે બજારમાં બેતરફી વધઘટનો ટ્રેન્ડ કહી શકાય.

ઈન્વેસ્ટરોની નજર આગામી દિવસોમાં દક્ષિણ આફ્રિકામાં પર્યેજિંગ પ્રાઈસ ઈન્ડેક્સ થું આવે છે અને ન્યુઝિલેન્ડમાં રીટેઈલ વેચાણના આંકડા કેવા આવે છે તેની ઉપર છે અને તે જ પ્રકારે તાઈવાન અને સિંગાપોર દ્વારા પોતાના ઔદ્યોગિક ઉત્પાદનના આંકડા અને કુવાળાના આંકડા જાહેર કરવામાં આવશે અને તેની ઉપર પણ એશિયાઈ શેરબજારોની નજર છે.

ભારતમાં અત્યારે આર્થિક દૃષ્ટિએ કોઈ નવા ડેવલપમેન્ટ નથી અને સરકાર ‘ઓપરેશન સિંદૂર’નો ચૂંટણીમાં લાભ લઈ શકાય તે માટે લાગી ગઈ છે. અને તે અંગેની ચૂંટણીસભાઓ અને અન્ય સભાઓમાં આજોજન થઈ રહ્યું છે. પરંતુ આર્થિકની દૃષ્ટિએ કોઈ નવા ડેવલપમેન્ટ નથી. સેબી ચેરમેન અત્યારે એકશનમાં છે અને તેમના દ્વારા એનએસઈના આઈપીઓને ઝડપથી મંજૂરી મળે તે અંગે પગલાઓ શરૂ કરાયા છે. આ ઉપરાંત સેબીમાં ઉચ્ચ લેવલ ઉપર પારદર્શકતા વધે તે અંગે પણ તેમણે પગલા લેવાનું શરૂ કર્યું છે.

બજારનો મૂડ સ્થિર થવાને કારણે પ્રમોટરો અને લીડ મેનેજરો ખૂબ જ ઝડપથી આઈપીઓ લાવીને ભંડોળ ઊભું કરવા સક્રિય થઈ ગયા છે અને નવા અઠવાડિયા દરમ્યાન અને તે પછી જૂના પ્રથમ અઠવાડિયા દરમ્યાન અનેક એસએમઈ અને મેઈનબોર્ડ આઈપીઓ બજારમાં દાખલ થશે. જાન્યુઆરીથી માર્ચના સમયગાળામાં ઓટોમોબાઈલ સેક્ટરમાં જે નબળાઈ હતી તે હવે ધીરે ધીરે ઘટવા લાગી છે. જાન્યુઆરી મહિનો એર્કદરે તંદુરસ્ત રહ્યો હતો અને તેમાં આગલા વર્ષનું મોમેન્ટમ મહદઅંશે જળવાયું હતું અને સાથે સાથે માર્ચ આખરને કારણે અનેક કંપનીઓ દ્વારા પ્રમોશન સ્કીમ શરૂ થઈ હોવાને કારણે તેનો લાભ પણ દેખાતો હતો પરંતુ તે પછી ફેબ્રુઆરી અને માર્ચમાં મહિના દરમ્યાન ઓટોમોબાઈલ સેક્ટરની માંગ ઠંડી પડવા લાગી અને માર્ચ મહિનો એર્કદરે લગભગ તમામ ઓટોમોબાઈલ કંપનીઓ માટે નબળો રહ્યો. કંપનીઓમાં વેચાણો વધે તે માટે કોઈક પોઝિટિવ કારણનો અભાવ હતો અને આ ટ્રેન્ડને કારણે લગભગ તમામ

ચાલતું હતું તેને બદલે અત્યારે ૯૨૭૦૦૦ શેરોનું વોલ્યુમ થવા લાગ્યું છે અને બજાજ ઓટોના શેરમાં પણ આવતા થોડા અઠવાડિયામાં સુંદર ઉછાળા સાથે રૂા. ૮૯૩૬ અને તે પછી ધીરે ધીરે રૂા. ૯૧૯૯નો ભાવ જોવા મળી જાય તે સંભાવના મજબૂત છે.

આઈપીઓ વખતે જોરદાર વાતો કરી રહેલા **હુંફમ** આઈપીઓ પછી ભાવ એકદમ તૂટી ગયો હતો. આ શેરમાં આઈપીઓ પછી રૂા. ૧૯૭૦ સુધી ભાવ ગયો હતો પરંતુ અત્યારે ૨૭.૫૭ના પીઈરેશિયો ઉપર રૂા. ૧૮૬૪ ઉપર ભઆવ ચાલે છે.હુંડઈમાં પણ માર્ચ ક્વાર્ટરના પરિણામો બિનપ્રોત્સાહક રહ્યા છે. વેચાણોમાં કેવળ ૨.૫૧ ટકાનો વધારો થયો અને તે પણ મુખ્યત્વે વેચાણ ક્રિંમતો વધવાને કારણે જ્યારે હુંડઈનો નફો માર્ચ ક્વાર્ટર દરમ્યાન ચાર ટકા ઘટ્યો છે અને પાસું હોવા છતાં હવે ધીરે ધીરે આ શેર તેજી તરફી આગળ વધતો જાય છે. હુંડઈની સરખામણીમાં મારૂતિ સુઝુકીનો શેર અત્યારે ૨૦ના પીઈરેશિયો ઉપર જ ચાલે છે અને તેમ છતાં તે શેરમાં અત્યારે ઉછાળો ધીમો છે અને તેથી તમારી પાસે આઈપીઓ વખતના અને તે પછી પણ લીધેલા હુંડઈનો શેરો હોય તો જાળવી રાખજો અને આવતા થોડા દિવસોમાં આ શેરમાં રૂા.૧૯૨૯ અને તે પછી રૂા. ૧૯૮૯નો ભાવ જોવા મળે તે સંભાવના મજબૂત છે અને તે પછી ધીમા સુધારા સાથે આ શેરમાં રૂા. ૨૦૪૦ના ભાવની સંભાવના મજબૂત છે.

ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં સુંદર માંગને કારણે **એસ્કોટ કુલોટા** શેરમાં આકર્ષણ વધ્યું છે. છેલ્લા થોડા દિવસોમાં ધીમા સુધારા સાથે આ શેર રૂા. ૩૫૫૦ ઉપર આવ્યો છે અને તેમાં પણ આવતા થોડા દિવસો દરમ્યાન રૂા. ૩૭૦૦ અને તે પછી રૂા. ૩૯૦૦નો ભાવ જોવા મળશે તે સંભાવના છે. ટ્રક ઉત્પાદકોમાં અત્યારના તબક્કે **અશોક લેલેન્ડ**માં આકર્ષણ વધારે છે. રૂા. ૨૪૧વાળા આ શેરે છેલ્લા એક જ અઠવાડિયામાં ૦.૬૨ ટકાનું રિટર્ન આપ્યું છે અને આ કાઉન્ટર ઉપરના સોદા પણ લગભગ ૫૦ ટકા જેટલા વધી ગયા છે. આવતા થોડા દિવસો દરમ્યાન અશોક લેલેન્ડના શેરમાં શોર્ટટર્મ ખેલાડીઓ રૂા. ૨૪૨ અને તે પછી રૂા. ૨૪૯નો ભાવ જોઈ રહ્યા છે અને તેથી રોકાણ જાળવી શકાય.

સામે પક્ષે **તાતા મોટર્સ**નો શેર છેલ્લા થોડા દિવસો દરમ્યાન જોરદાર તૂટ્યો હતો અને અત્યારે રૂા. ૭૨૦ ઉપર આવી ગયેલા આ શેરમાં ફક્ત ૧૧.૧૬નો પીઈરેશિયો ચાલે છે. માર્ચ ક્વાર્ટર દરમ્યાન તાતા મોટર્સનો નફો ૪૯.૫૮ ટકા ટૂટ્યો છે જ્યારે વેચાણોમાં ૦.૩૯ ટકાનો ઉછાળો આવ્યો છે. અને આગામી દિવસોમાં આ શેરમાં લગભગ ૩થી ૬ મહિના જાળવનારને સુંદર રિટર્ન છૂટશે તે સંભાવના મજબૂત છે. એકદમ શોર્ટટર્મમાં આ શેરમાં મોટો ઉછાળો આવી જાય તેવી આશા ન રાખવી.

**ફોર્સ મોટર્સ**ના શેરે પણ ધીમો સુધારો બતાવવાનું શરૂ કર્યું છે. અત્યારે રૂા. ૧૦૭૦૯ ઉપર છે અને આ શેરમાં એક વર્ષ અગાઉ લોન્ચ થયેલી અર્બનિયાને ખૂબ જ સુંદર પ્રતિભાવ મળી રહ્યો છે. આ શેર પણ આવતા થોડા દિવસો દરમ્યાન એકદમ ધીમા સુધારા સાથે રૂા. ૧૦૭૦૦ અને તે પછી રૂા. ૧૦૬૬૮નો ભાવ બતાવી દે તે સંભાવના મજબૂત છે.

**ટીવીએસ મોટર** કંપનીનો શેર એમ તો ગયા અઠવાડિયે ૧.૮૧ ટકા ટૂટ્યો હતો અને આ કાઉન્ટર ઉપર અત્યારે વોલ્યુમ પણ ઓછું છે. ટીવીએસ મોટર કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં અફલાતુન પરિણામો હાંસલ કર્યા છે. માર્ચ ક્વાર્ટરમાં વેચાણો ૧૬ ટકા વધ્યા અને નફામાં ૬૮ ટકાનો તોતિંગ ઉછાળો બતાવ્યો છે અને તે રીતે

અત્યારે વોલ્યુમની દૃષ્ટિએ લાંબો કસ નથી. વેલ્યુએશન પણ એર્કદરે ઊંચું છે અને તે પાસાને ધ્યાનમાં રાખીએ તો આ શેરમાં એર્કદરે નાની રેન્જમાં જ ભાવ અથડાયા કરે તે સંભાવના મજબૂત છે અને તેથી શોર્ટટર્મ માટે લેવાની ઉતાવળ ન કરાય.

ઓટોએન્સિલરી સેક્ટરમાં હવે આકર્ષણ વધ્યું છે અને ગયા અઠવાડિયા એસી સિસ્ટમ બનાવતી હતી પરંતુ હવે ટ્રકની કેબિનો માટે અને રેલવેના કોચ માટે પણ એસી સિસ્ટમ સપ્લાય કરે છે અને તેને કારણે તેના વેચાણો અને નફાશક્તિમાં ખૂબ જ સુંદર ઉછાળો શરૂ થઈ ગયો છે. માર્ચ ક્વાર્ટર દરમ્યાન સમ્રોસના નફામાં ૫૧.૮૨ ટકાનો તોતિંગ ઉછાળો જોવાયો અને પરિણામોની આ જાહેરાત પછી શેરમાં જોરદાર લેવાલી શરૂ થઈ ગઈ છે. અગાઉ ૮૨૦૦૦ શેરોનું સરેરાશ વોલ્યુમ ચાલતું હતું તે વધીને અત્યારે ૩૬૩૦૦૦ શેરોનું થઈ ગયું છે. રૂા. ૭૭૭ અને તે પછી રૂા. ૮૩૫નો ભાવ જોવા મળી જાય તે સંભાવના મજબૂત છે.

તે જ પ્રકારે રૂા. ૨૪૦૧ વાળા **એન્ડચોરન્સ ટેકનોલોજી**ના શેરમાં પણ થોડોક ઉછાળો જોવા મળવાની ગણતરી છે.

રૂા. ૬૬૨ના ભાવે મળી રહેલા **લુમેક્સ ઓટો ટેકનોલોજી**ના શેરમાં પણ ફોકસ રમાય અને તેમાં પણ આવતા થોડા દિવસો દરમ્યાન મજબૂત ઉછાળા સાથે રૂા. ૬૯૬ અને તે પછી રૂા. ૭૫૦નો ભાવ જોવા મળવાની સંભાવના મજબૂત છે. થોડુંક રોકાણ કરી શકાય.

નીચા ભાવનો શેર લેવો હોય તેને માટે રૂા. ૧૩૪ ઉપરનો **મુંબલ શોવા** ખાસ ધ્યાન ખેંચે છે. અનેક ખેલાડીઓએ આ શેર કવર કરવાનું શરૂ કર્યું છે. અગાઉ ૪૯૦૦૦ શેરોનું સરેરાશ વોલ્યુમ રહેતું હતું અને તે વધીને અત્યારે ૧૯૩૦૦૦ શેર ઉપર આવી ગયું છે. મુંજલ શેરોનો શેર

By Order of the Board  
For, Polylink Polymers (India) Limited  
Sd/-  
RAVIPRAKASH HARISHANKAR GOYAL  
DIRECTOR  
DIN : 00040570

Date : 23rd May, 2025  
Place : Ahmedabad

By Order of the Board  
For, Polylink Polymers (India) Limited  
Sd/-  
RAVIPRAKASH HARISHANKAR GOYAL  
DIRECTOR  
DIN : 00040570

Date : 23rd May, 2025  
Place : Ahmedabad

By Order of the Board  
For, Polylink Polymers (India) Limited  
Sd/-  
RAVIPRAKASH HARISHANKAR GOYAL  
DIRECTOR  
DIN : 00040570

Date : 23rd May, 2025  
Place : Ahmedabad

By Order of the Board  
For, Polylink Polymers (India) Limited  
Sd/-  
RAVIPRAKASH HARISHANKAR GOYAL  
DIRECTOR  
DIN : 00040570

Date : 23rd May, 2025  
Place : Ahmedabad

By Order of the Board  
For, Polylink Polymers (India) Limited  
Sd/-  
RAVIPRAKASH HARISHANKAR GOYAL  
DIRECTOR  
DIN : 00040570

Date : 23rd May, 2025  
Place : Ahmedabad

By Order of the Board  
For, Polylink Polymers (India) Limited  
Sd/-  
RAVIPRAKASH HARISHANKAR GOYAL  
DIRECTOR  
DIN : 00040570

Date : 23rd May, 2025  
Place : Ahmedabad

By Order of the Board  
For, Polylink Polymers (India) Limited  
Sd/-  
RAVIPRAKASH HARISHANKAR GOYAL  
DIRECTOR  
DIN : 00040570

Date : 23rd May, 2025  
Place : Ahmedabad

By Order of the Board  
For, Polylink Polymers (India) Limited  
Sd/-  
RAVIPRAKASH HARISHANKAR GOYAL  
DIRECTOR  
DIN : 00040570

Date : 23rd May, 2025  
Place : Ahmedabad

By Order of the Board  
For, Polylink Polymers (India) Limited  
Sd/-  
RAVIPRAKASH HARISHANKAR GOYAL  
DIRECTOR  
DIN : 00040570

Date : 23rd May, 2025  
Place : Ahmedabad

By Order of the Board  
For, Polylink Polymers (India) Limited  
Sd/-  
RAVIPRAKASH HARISHANKAR GOYAL  
DIRECTOR  
DIN : 00040570

Date : 23rd May, 2025  
Place : Ahmedabad

By Order of the Board  
For, Polylink Polymers (India) Limited  
Sd/-  
RAVIPRAKASH HARISHANKAR GOYAL  
DIRECTOR  
DIN : 00040570

Date : 23rd May, 2025  
Place : Ahmedabad

By Order of the Board  
For, Polylink Polymers (India) Limited  
Sd/-  
RAVIPRAKASH HARISHANKAR GOYAL  
DIRECTOR  
DIN : 00040570

Date : 23rd May, 2025  
Place : Ahmedabad

By Order of the Board  
For, Polylink Polymers (India) Limited  
Sd/-  
RAVIPRAKASH HARISHANKAR GOYAL  
DIRECTOR  
DIN : 00040570

Date : 23rd May, 2025  
Place : Ahmedabad

By Order of the Board  
For, Polylink Polymers (India) Limited  
Sd/-  
RAVIPRAKASH HARISHANKAR GOYAL  
DIRECTOR  
DIN : 00040570

Date : 23rd May, 2025  
Place : Ahmedabad

By Order of the Board  
For, Polylink Polymers (India) Limited  
Sd/-  
RAVIPRAKASH HARISHANKAR GOYAL  
DIRECTOR  
DIN : 00040570

Date : 23rd May, 2025  
Place : Ahmedabad

By Order of the Board  
For, Polylink Polymers (India) Limited  
Sd/-  
RAVIPRAKASH HARISHANKAR GOYAL  
DIRECTOR  
DIN : 00040570

Date : 23rd May, 2025  
Place : Ahmedabad

By Order of the Board  
For, Polylink Polymers (India) Limited  
Sd/-  
RAVIPRAKASH HARISHANKAR GOYAL  
DIRECTOR  
DIN : 00040570

Date : 23rd May, 2025  
Place : Ahmedabad

By Order of the Board  
For, Polylink Polymers (India) Limited  
Sd/-  
RAVIPRAKASH HARISHANKAR GOYAL  
DIRECTOR  
DIN : 00040570

Date : 23rd May, 2025  
Place : Ahmedabad

By Order of the Board  
For, Polylink Polymers (India) Limited  
Sd/-  
RAVIPRAKASH HARISHANKAR GOYAL  
DIRECTOR  
DIN : 00040570

Date : 23rd May, 2025  
Place : Ahmedabad

By Order of the Board  
For, Polylink Polymers (India) Limited  
Sd/-  
RAVIPRAKASH HARISHANKAR GOYAL  
DIRECTOR  
DIN : 00040570

Date : 23rd May, 2025  
Place : Ahmedabad

By Order of the Board  
For, Polylink Polymers (India) Limited  
Sd/-  
RAVIPRAKASH HARISHANKAR GOYAL  
DIRECTOR  
DIN : 00040570

Date : 23rd May, 2025  
Place : Ahmedabad

By Order of the Board  
For, Polylink Polymers (India) Limited  
Sd/-  
RAVIPRAKASH HARISHANKAR GOYAL  
DIRECTOR  
DIN : 00040570

Date : 23rd May, 2025  
Place : Ahmedabad

By Order of the Board  
For, Polylink Polymers (India) Limited  
Sd/-  
RAVIPRAKASH HARISHANKAR GOYAL  
DIRECTOR  
DIN : 00040570

Date : 23rd May, 2025  
Place : Ahmedabad

By Order of the Board  
For, Polylink Polymers (India) Limited  
Sd/-  
RAVIPRAKASH HARISHANKAR GOYAL  
DIRECTOR  
DIN : 00040570

Date : 23rd May, 2025  
Place : Ahmedabad

By Order of the Board  
For, Polylink Polymers (India) Limited  
Sd/-  
RAVIPRAKASH HARISHANKAR GOYAL  
DIRECTOR  
DIN : 00040570

Date

## Tata Digital CEO Tahilyani resigns after a year, joins Prudential

Naveen Tahilyani, the chief executive officer (CEO) and managing director of Tata Digital, has stepped down over a year after joining the company. Tahilyani, who took over the reins in February 2024, was handpicked by Tata Sons Chairman N Chandrasekaran to turn around the company which has been lagging other e-commerce and quick commerce players.

Tahilyani has now joined Prudential plc, a British-domiciled multinational insurance and asset management company, where he will be the regional CEO for India, Africa, the Philippines, Cambodia, Laos, and Myanmar, with responsibility for the health vertical, the company said in a press release.

Tahilyani, a Tata veteran, was previously the CEO of Tata AIA Life Insurance. Immediately after his appointment, Tahilyani announced a rejig and a focus to streamline the structure of leadership and make the firm nimble and business focussed.

Soon the total number of leaders reporting directly to Tahilyani came down to 20, from 35 who reported to the former CEO Pratik Lal. Tahilyani also focused on building the financial offering of the company, loyalty programme and improve customer stickiness.

In the financial segment,

## Biocon Biologics gets six-month extension of insulin supply in Malaysia

Biocon arm Biocon Biologics Limited (BBL) said in a statement that the Malaysian Ministry of Health has extended the insulin supply contract with the company.

“Biocon Biologics is pleased to inform that the Government of Malaysia has agreed to extend the current contract period of 36 months under the existing insulin supply agreement with its subsidiary in Malaysia, Biocon Sdn. Bhd., and Duopharma Marketing Sdn. Bhd. (DMktg), for an additional six (6) months, effective from 29 April 2025 until 28 October 2025,” said a company spokesperson.

Biocon Biologics further

## Emcure Q4 profit jumps 63%, domestic business drives 19.5% revenue rise

Emcure Pharmaceuticals posted a 63 per cent year-on-year (Y-o-Y) growth in its consolidated net profit at Rs.197.2 crore for the March quarter of financial year 2024-25 (Q4FY25), up from Rs.121 crore in the same period last year.

The company’s revenue from operations rose to Rs.2,116.2 crore, a 19.5 per cent increase from Rs.1,771.3 crore in Q4FY24.

Sequentially, net profit rose by 26.4 per cent, while revenue from operations grew by 7.8 per cent from Rs.156 crore and Rs.1,936 crore, respectively, in Q3FY25.

The company attributed this growth to strong performance across Emcure’s domestic and international businesses.

Tahilyani’s strategy to attract customers worked, as its credit card offering crossed 1.5 million user bases in October 2024. This was up from 1.18 million card at the end of FY24 (March 31, 2024).

According to Tata Digital’s FY24 annual report its financial services has witnessed significant growth, with its co-branded credit card reaching 1.18 million cards. The company said that it is the fastest growing co-branded credit card in India.

Chandrasekaran in an email to employees on the sudden exit of Tahilyani said, “Over the past year Tata Digital (standalone) has delivered a strong performance across key metrics. Our commerce gross merchandise value has grown by 109 per cent and the financial services payments value have increased by over 60 per cent while continuing to improve profitability.”

He went on to add that the company has made progress in shaping effective business models and collaborating with our subsidiaries. “All of this has been achieved under the leadership of Naveen who has played a pivotal role in strengthening our foundation and setting the strategic direction,” said Chandrasekaran.

“I will be announcing, his successor in the next few days to enable a smooth transition

over the coming weeks,” added Chandrasekaran.

While Tahilyani focused on streamlining the operations, Tata Neu is still unable to bring the power of the Tata group companies to the platform. In the recent times the financial offering had started to do well, it was only IHCL and Croma that have been well integrated into the Tata Neu platform. This integration is evident in Bigbasket’s foray into quick commerce and electronics goods.

In the recent time the company also saw some external hiring on senior level. These included Vinay Vaidya, who was appointed as the chief technology officer. He joined Tata Digital from Amazon. Satyam Mehra, chief strategy officer, who joined from Zomato and Jairaj Sathyanarayana, chief data and AI officer, who joined from Swiggy.

But in the past, the company has seen several exits. Mukesh Bansal, founder of Myntra quit the firm in 2022, many senior leaders have exited post that. In 2024, Pavan Podila, head of architecture and Samir Aksekar, chief information security officer exited.

Tata Digital saw its losses narrow for FY24 at Rs.1,200.82 crore. Losses for FY23 came in at Rs.1,370.09 crore, according to the FY24 Annual Report of Tata Sons. Revenue for FY24 almost doubled from Rs.204.35 crore in FY23 to Rs.420.51 crore.

remains committed to providing affordable access to life-saving insulins for people with diabetes in Malaysia and globally.

The company has been supplying insulin products to Malaysia for over a decade. Additionally, it operates an integrated insulin manufacturing facility in Johor, in southern Malaysia. Biocon Biologics received US Food and Drug Administration (FDA) approval for this facility earlier this year, in January.

Let me know if you'd like a version tailored for social media, a press note, or infographic format.

Emcure’s domestic business grew by 24.8 per cent Y-o-Y to Rs.929 crore, led by growth in its women’s health and cardiology franchises. “It was further aided by our new focus areas of dermatology and over-the-counter (OTC),” the company said in a regulatory filing to the exchanges.

The company also recorded a 15.6 per cent growth in international business to Rs.1,187 crore in the March quarter, up from Rs.1,027 crore in the same period last year. This was led by a 39.3 per cent Y-o-Y revenue rise in the Rest of the World segment to Rs.481 crore in Q4FY25 from Rs.345 crore. Emcure’s Canada business also reported a 6.2 per cent Y-o-Y growth in revenue to Rs.310 crore in Q4FY25 from Rs.293 crore in Q4FY24, while revenue in the European Union (EU) business rose by 1.7 per

## Adani Group FY25 ebitda up 8.2% at Rs 89,806 cr, infra sectors drive growth

The Adani Group reported a consolidated ebitda of Rs 89,806 crore in FY25, driven by growth in core infrastructure sectors and higher operating cash flows across its portfolio. Ebitda was up 8.2 per cent compared to Rs 82,976 crore reported by group listed companies in FY24, said Adani in a media statement.

The conglomerate, with interests ranging from energy and logistics to cement and mining, reported a capital expenditure of Rs 1.26 trillion — its highest — and said it plans to invest \$100 billion in the next six years. The investments will reflect the group’s focus on building long-term infrastructure assets, including renewable energy projects, transmission networks, ports, and a new copper smelter facility, it said.

Return on assets in FY25 stood at 16.5 per cent, which Adani said places it among the highest-performing infrastructure businesses globally. The group’s gross assets have grown at a compound annual rate of more than 25 percent since FY2019, reaching Rs 6.1 trillion (\$71.2 billion).

Alongside growth, the group reduced its leverage. Net debt-to-ebitda declined to 2.6x, down from 3.8x in FY19. Liquidity remains strong, with a reported cash balance of Rs 53,843 crore (\$6.3 billion), representing approximately 18.5 percent of gross debt. The average cost of borrowing fell below 8 per cent for the first time, a result the company attributed to improved credit ratings and access to lower-cost capital, the statement said.

Roughly 90 per cent of the Group’s ebitda now originates from assets rated ‘AA’ or above domestically, according to the company. It also cited improvements in environmental, social, and governance scores and governance-related disclosures as contributing factors to the decline in borrowing costs.

Adani Group’s acquisition of a controlling stake in ITD Cementation India through a Rs 3,204 crore deal marks the conglomerate’s entry into the engineering and construction (EPC) sector. With this

## Fitch upgrades India's medium-term growth outlook to 6.4% till FY26

Fitch Ratings revised India’s medium-term GDP growth potential till FY2026 upwards to 6.4 per cent, from its earlier projection of 6.2 per cent.

“We have increased potential growth in India by 0.2pp to 6.4 per cent as higher estimates for labour force participation more than offset a lower contribution from labour productivity,” the ratings agency said, while noting that there has been “less pandemic scarring in India”.

Fitch Ratings has slightly lowered its medium-term potential GDP projections over the next five years for the 10 emerging market economies

purchase, the group aims to leverage its capital expenditure

Adani’s core infrastructure businesses contributed 82 per cent of total ebitda. In the utility segment, Adani Green Energy increased its operational capacity by 30 percent year-on-year, while Adani Power reported a 20 percent rise in electricity generation. (Ebitda is earnings before interest, taxes, depreciation, and amortisation.)

The transport segment, led by Adani Ports & SEZ, delivered a 19 per cent increase in ebitda, aided by a 20 per cent surge in container volumes. Ambuja Cements, a family-owned business, reported a capacity increase to 100 million tonnes per annum, following expansions across multiple plants.

“India’s consumption engine remains strong,” said Karan Adani, chief executive officer of Adani Ports & SEZ and Chairman of ACC Ltd. “As manufacturing grows, trade volumes will surge. For us, any trade — import or export — is good business.” APSEZ plans to build a fully integrated logistics platform spanning factory gates to end consumers, with an eye on becoming the largest player not just in ports but across the supply chain. “We’re already moving over 500 million tonnes annually,” said Karan Adani.

Adani Enterprises, the group’s incubator for emerging infrastructure businesses, saw a 26.6 per cent year-on-year rise in ebitda. It noted significant progress in its road construction and airport operations, as well as the operationalisation of a large-scale copper smelter in Mundra.

The group said its strategy is focused on scale, capital efficiency, and financial management. “Our asset base and operating leverage continue to support stable returns, even as we invest aggressively in new platforms,” said Jugeshinder ‘Robbie’ Singh, Adani Group’s chief financial officer.

The group said it has sufficient liquidity to meet debt obligations for at least the next 12 months and its balance sheet allows coverage for over 21 months.

covered in its Global Economic Outlook.

“Our update of potential growth in emerging markets is now 3.9 per cent, representing a further, albeit marginal, drop from the 4 per cent estimate we published in November 2023.

This mainly reflects lower potential growth in China,” said Robert Sierra, Director, Fitch Ratings.

Fitch expects total factor productivity in India to slow from recent years, reverting to its long-run average of 1.5 per cent. It also anticipates India’s labour force participation rate will continue to increase, albeit at a slower pace.

Ahmedabad 24-05-2025

## India to surpass China in oil demand growth over next decade: Moody's

China drove global oil demand growth over the last decade, but now India is poised to take the lead in demand growth over the next decade, according to a latest report by Moody's Ratings.

China and India are No. 2 and No.3 oil consumers in the world. But there are notable differences in demand growth in the two countries.

"Demand growth and import reliance will be higher in India," Moody's said. "Demand will grow faster in India than in China over the next decade, as China's economic growth slows and penetration of new energy vehicles accelerates."

Consumption of crude oil - the raw material for making fuels like petrol and diesel - in China will peak in the next 3-5 years, while in India Moody's expects annual growth of 3-5 per cent in the same period.

Stating that both countries rely heavily on oil and gas imports, the rating agency said it expects China's reliance on oil imports to fall, reflecting slower demand growth and increased domestic production.

"India's reliance on imports will increase if it is unable to stem a production decline," it said.

Moody's said China's larger oil and gas consumption underpins the scale of its national oil companies (NOCs), which will likely outpace their Indian peers in production growth over the next 3-5 years.

Investments in complex shale gas and offshore projects bolster Chinese NOCs' reserves and production, while Indian NOCs face challenges from aging wells and slow investment.

Additionally, Chinese

NOCs' greater value chain integration mitigates earnings volatility, and they have lower leverage and higher interest coverage. Moody's saw investment focus vary, reflecting national objectives.

"Chinese NOCs continue to invest heavily in exploration and development to enhance self-sufficiency. Their investments in the downstream refining and petrochemical sectors will gradually decline over the next 3-5 years as most major projects have been completed. By contrast, NOCs in India will still invest heavily to expand refining and petrochemical facilities over the next five years to meet growing domestic demand," it said.

"Indian NOCs plan to boost domestic oil and gas production but execution remains to be seen," it added.

Government policies in China are more market-oriented, it said, adding that policies in both countries are aimed at maintaining price stability and adequate supply.

"The effect of policy is more pronounced on companies in India as pricing mechanisms have led to bigger swings in earnings and cash flows. India relies more on taxes and dividends from its petroleum sector to support its fiscal budget than China," it said.

As carbon regulation in India is still developing, Indian NOCs face less immediate pressure to invest in green technologies compared to Chinese NOCs, which face stricter rules and the need to transition to green practices more quickly.

Both countries rely heavily on oil and gas imports. But Moody's expected China's reliance on oil imports will fall,

driven by slower demand growth and its push for self-sufficiency amid geopolitical tensions.

China's oil demand is expected to grow marginally to peak at around 800 million tonnes per annum (mmta) by 2030. Apart from slower economic growth, China's oil demand growth is also constrained by the country's shift toward cleaner energy.


Fast adoption of NEVs (New Energy Vehicles) and the expansion of renewable energy will reduce China's need for oil products like diesel and gasoline. However, the country's consumption of jet fuel and naphtha will likely rise because of increasing air travel and petrochemical production.

Refining capacity in China is also near the state-mandated cap of 1 billion tonnes. This limits the potential for demand growth of crude oil, which is the feedstock for refineries. By contrast, India aims to increase its refining capacity by a fifth to 309.5 mmta by 2030 from 256.8 mmta as of April 1, 2024.

Rising economic growth and industrialisation, along with the government's heavy investments in infrastructure that will enhance accessibility and mobility, will drive demand growth for transportation fuels in India.

The state-owned oil marketing companies (OMCs) in India - Bharat Petroleum Corporation Ltd, Hindustan Petroleum Corporation Ltd and Indian Oil Corporation - have ramped up investments to boost refining capacity in recent years.

On gas demand, Moody's said the pace of demand growth for natural gas in India will be slightly higher than China's.

| POLYLINK POLYMERS (INDIA) LIMITED  |  |                          |                          |                          |   |                       |
|--|--|--------------------------|--------------------------|--------------------------|---|-----------------------|
| CIN :L17299GJ1993PLC032905   |  |                          |                          |                          |   |                       |
| Regd. Office & Works : Block No. 229-230, Valthera, Tal - Dholka, Dist. - Ahmedabad-387810   |  |                          |                          |                          |   |                       |
| Phone No.079-26427800 FAX No.079-26421864  |  |                          |                          |                          |   |                       |
| Email: polylink@polylinkpolymers.com; website: www.polylinkpolymers.com  |  |                          |                          |                          |   |                       |
| Extract of statement of Audited Financial Results for the Quarter and Year Ended March 31, 2025 (Rs. in Lacs)  |  |                          |                          |                          |   |                       |
| SR. NO.  | PARTICULARS  | Quarter Ended 31.03.2025 | Quarter Ended 31.12.2024 | Quarter Ended 31.03.2024 | Year Ended 31.03.2025   | Year Ended 31.03.2024 |
|  |  | (Audited)                | (Unaudited)              | (Audited)                | (Audited)   | (Audited)             |
| 1  | Total Income from operations   | 2,407.07                 | 2,255.30                 | 2,245.35                 | 9,151.04  | 7,491.04              |
| 2  | Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)  | (12.48)                  | 130.27                   | 109.31                   | 297.41  | 231.39                |
| 3  | Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)   | (12.48)                  | 130.27                   | 109.31                   | 297.41  | 231.39                |
| 4  | Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)  | (10.08)                  | 94.70                    | 78.98                    | 213.20  | 173.18                |
| 5  | Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)] | (14.40)                  | 94.70                    | 78.40                    | 208.88  | 172.60                |
| 6  | Equity Share Capital   | 1,105.58                 | 1,105.58                 | 1,105.58                 | 1,105.58  | 1,105.58              |
| 7  | Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year  | -                        | -                        | -                        | -   | 1,675.87              |
| 8  | Earnings Per Share (of Rs.5/- each) (for continuing and discontinued operations)   | (0.05)                   | 0.43                     | 0.36                     | 0.96  | 0.78                  |
|  | (a) Basic (Rs)   | (0.05)                   | 0.43                     | 0.36                     | 0.96  | 0.78                  |
|  | (b) Diluted (Rs)   | (0.05)                   | 0.43                     | 0.36                     | 0.96  | 0.78                  |
| <b>Notes:</b>  |  |                          |                          |                          |   |                       |
| 1. The above Standalone Financial Results of the company for the Quarter and year ended March 31, 2025 were reviewed and recommended by the Audit Committee and approved by the Board of Directors at their respective meeting held on May 23, 2025 and Audited by the statutory auditor of the company. The Statutory Auditors have expressed an un-modified audit opinion. The financial results are being Published in accordance with Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.as required under Regulation 33 of SEBI ( Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.The audit report of the statutory auditors is being filed with the Bombay Stock Exchange. |  |                          |                          |                          |  |                       |
| 2. This statement has been prepared in accordance with the Companies (Indian Accounting Standards) 4 Rules, 2015 (Ind AS), prescribed under section 133 of the Companies Act, 2013, and other recognized accounting practices and policies to the extent applicable.   |  |                          |                          |                          |   |                       |
| 3. Segment reporting as defined in IND-AS 108 is not applicable; since the Company has only one reportable segment i.e. manufacture and sale of polymeric compounds  |  |                          |                          |                          |   |                       |
| 4. The above is an extract of the detailed format of Quarterly/ Annual Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/ Annual Financial Results is available on the Stock Exchange websites at www.bseindia.com and website of the Company at www.polylinkpolymers.com   |  |                          |                          |                          |   |                       |
| By Order of the Board<br>For, Polylink Polymers (India) Limited<br>Sd/-<br>RAVIPRAKASH HARISHANKAR GOYAL<br>DIRECTOR<br>DIN : 00040570   |  |                          |                          |                          |   |                       |
| Date : 23rd May, 2025<br>Place : Ahmedabad   |  |                          |                          |                          |   |                       |